

પ્રહ્લાદ



હિરણ્યકશિપુ નામે એક રાજા હતો. એ સ્વભાવે અભિમાની હતો. પોતાનાથી કોઈને એ મોટો ગણતો નહિ. એ રાજ્યમાં સૌ કોઈને કહેતો, ‘તમારે મારાથી કોઈને મોટું નહિ ગણવું.’

રાજાને પ્રહ્લાદ નામે પુત્ર હતો. પ્રહ્લાદ નાનપણથી પ્રભુનું નામ રટ્યા કરતો. પિતાને એ વાતની જાણ થઈ ને એ કોધે ભરાયો. પ્રહ્લાદને એણે કહી દીધું, ‘તું ભગવાનનું નામ લેવાનું છોડી દે.’

પ્રહ્લાદને શું સૂજ્યું તે કહી દીધું, ‘એ નહીં બને.’

રાજા ખૂબ ગુસ્સે ભરાયો. એને હડોહડ અપમાન લાગ્યું. એણે કહી દીધું, ‘તું ભગવાનનું નામ લેવું નહીં છોડે તો હું તને આકરામાં આકરી શિક્ષા કરીશ.’

પ્રહ્લાદ કહ્યું, ‘પિતાજ ! મારાથી આપનો હુકમ નહિ પાળી શકાય, કેમ કે હું ભગવાનનું નામ લેવાનું છોડી શકું તેમ નથી..’

રાજાએ ગુસ્સે ભરાઈ પ્રહ્લાદને પહાડ પરથી ફેંકી દેવરાવ્યો. પ્રહ્લાદને કશી ઈજા ન થઈ ને આવીને એણે ભગવાનનું નામ ચાલુ કરી દીધું.

રાજાએ ગુસ્સે ભરાઈ પ્રહ્લાદને સાગરમાં ફેંકી દેવરાવ્યો. પ્રહ્લાદને કશી ઈજા ન થઈ ને આવીને એણે ભગવાનનું નામ ચાલુ કરી દીધું.

રાજાએ ગુસ્સે ભરાઈ પ્રહ્લાદને કહ્યું, “તો તું આકરામાં આકરી સજા માટે તૈયાર રહેજો.”

પ્રહૂલાદ કહી દીધું, “પિતાજ ! તમને ગમે તે તમે કરો ને મને ગમે તે હું કરીશ. ભગવાનનું નામ મને ગમે છે એટલે હું છોડીશ નહિ. ભગવાન સર્વવ્યાપી છે. એમને હું કેમ છોડી શકું ?”

હિરણ્યકશિપુએ આકરામાં આકરી સજા નક્કી કરી. એને હોલિકા નામે એક બહેન હતી. આગમાં પણ બળે નહિ એવું એને વરદાન હતું. રાજાએ એને કહું, “બહેન, પ્રહૂલાદને મારે આકરામાં આકરી સજા કરવી છે. એને આગમાં બાળવો છે. હું ચિત્તા ખડકાવરાવું. તું ખોળામાં પ્રહૂલાદને લઈ એમાં બેસ. આગ પ્રજળતાં પ્રહૂલાદ બળી મરશે ને તું તને મળેલા વરદાનને કારણે ઊગરી જઈશ.”

હોલિકા તૈયાર થઈ. ચિત્તા ખડકાઈ. હોલિકા પ્રહૂલાદને ખોળામાં લઈ એમાં બેઠી. ચિત્તા સળગાવાઈ. પ્રહૂલાદ ભગવાનનું નામ લેતો જિલજિલ હસ્યો ને હોલિકા આગથી લપેટાતાં ચીસો પાડવા લાગી. થોડી વારમાં હોલિકા આગમાં બળી ગઈ; પ્રહૂલાદ ભગવાનનું નામ બોલતો બહાર આવ્યો. લોકોએ એને વધાવી લીધો. હિરણ્યકશિપુના ગુસ્સાને સીમા ન રહી.

બીજે દિવસે રાજાએ પ્રહૂલાદને સભામાં બોલાવી મંગાવ્યો. એક લોઢાના મોટા થાંભલાને લાલચોળ ગરમ કરાવ્યો. પછી પ્રહૂલાદને પૂછ્યું, “બોલ આમાં તારો ભગવાન છે ?” પ્રહૂલાદ કહું, “હા પિતાજ, એનો દરેક જગ્યાએ વાસ છે.” પુત્રના ઉત્તરથી પિતા ગુર્સે થયા. એણે આજ્ઞા કરી, “તો બંને હાથથી આ થાંભલાને પકડ ને તારા ભગવાનને ભેટ. જોઉં કે તારો ભગવાન કેવો બધે વસેલો છે !”

પ્રહૂલાદને ભગવાનમાં વિશ્વાસ હતો. ડર્યા વિના એણે બંને હાથે થાંભલાને બાથ ભરાવી. ત્યાં તો મોટા અવાજ સાથે થાંભલો ફાટ્યો. થાંભલામાંથી નરસિંહ ભગવાન નીકળ્યા : માથું સિંહનું ને આકાર નર એટલે કે માણસનો.

નરસિંહ ભગવાને હિરણ્યકશિપુને પકડીને દરવાજાના ઉંબર ઉપર લીધો. પછી પોતાના મોટા નખ વડે ફાડી નાખ્યો ને પ્રહૂલાદનું રક્ષણ કર્યું.

લોકોએ પ્રહૂલાદનો જ્યજ્યકાર કર્યો. ભગવાને પ્રહૂલાદને હિરણ્યકશિપુની ગાદીએ બેસાડ્યો.

— રત્નલાલ સાં. નાયક